




રાજકોટ મહાનગરપાલિકા

ટાઉન પ્લાનિંગ અમલીકરણ શાખા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ.




ગામનું નામ : રાજકોટ

ટી.પી.સ્કીમ નં.: ૨

અંતિમ ખંડ નંબર.: ૩૨૨


સ્કેલ :- ૧ સે.મી. -.....૧૦.૦૦ મીટર




ઈ.નં. ૨૧-૨૦

પ.નં. ૨૭૮૨૮

તા. ૨૨/૦૮/૨૦૨૨


તૈયાર કરનાર
જી.પ્રાફ્ટમેન / ટ્રેસર


આસી. ટાઉન પ્લાનર,
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન



RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHRI CHIMANIBHAI PATEL VIKAS BHAVAN, POST BOX NO. 238, JAMNAGAR ROAD, RAJKOT.

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટી./દિ.પુ.વિ.ચો./૨૦૩૧/૨૩૫૮

તા. ૦૬-૧૦-૨૦૨૦

પ્રતિ

શ્રી રાજેશભાઈ ભગવાનજીભાઈ પરસાણા

C/o. સૌરભ પી. પટેલ (એડવોકેટ)

અદ્રેશ સુખમ, ૪થો માળ,

સંસ્કાર બિલ્ડીંગની પાછળ,

કે.કે.વી. ચોકની બાજુમાં

૧૫૦ ફુટ રીંગ રોડ,

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૨૯-૦૯-૨૦૨૦ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- રાજકોટ તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- --- અંતિમ ખંડ નં.- ૩૨૫ પ્લોટ નં.- ૧૧ ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨- એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોનમાં સુચિત કરાયેલ છે.

સદરહુ જમીન મોજે - રાજકોટ ની ટી.પી. સ્કીમ નં.- ૦૨ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ


A.P.P. રાજકોટ

RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



PART PLAN OF SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act.1976
Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016/DVP-13-2016-223702-L,Dated 27-10-2016.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.
NOTE :. This part plan can not be used for making any entry in revenue records and can not be considered as Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY NO. --
VILLAGE: RAJKOT
TALUKA: RAJKOT
T.P.S. NO.: 02
F.P. NO.: 325



Scale : 1Cm. = 20 Mt.

LEGEND :

- FP BOUNDARY
- T.P. SCHEME ROAD
- RESIDENTIAL

Prepared By : A.D.P.
Checked By :
Date : 5-OCT-2020

TRUE COPY

JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT